

Ref: OFL/BSE/2026
Date: 10.04.2026

To,
The Corporate Relations Department
BSE Limited
Department of Corporate Services
PJ Towers, Dalal Street, Fort,
Mumbai-400001.

Re: Optimus Finance Limited
Scrip Code: 531254

Subject: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time - Newspaper Publication for publicizing special window for Re-lodgement of Transfer Requests of physical shares.

Ref: SEBI Circular no. HO/38/13/11(2)2026-MIRSD-POD/I/3750/2026 dated January 30, 2026

Dear Sir/Madam,

In accordance with SEBI circular no HO/38/13/11(2)2026-MIRSD-POD/I/3750/2026 dated January 30, 2026, another special window has been opened for re-lodgement of transfer deeds which were lodged prior to the deadline of April 01, 2019 and rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise, are now granted opportunity to re-lodge their transfer requests. The special window will remain open for a period of one year from February 5, 2026 to February 4, 2027. The securities that are re-lodged for transfer shall be credited to the transferee only in demat mode and shall be under lock-in for a period of one year from the date of registration of transfer.

In view of aforesaid, the Company has made a publication in the Business Standard and Loksatta Jansatta(the Newspapers) on April 10, 2026 and submitting the same to the Exchange for record.

The aforesaid submission is being made in terms of Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, as amended from time to time.

The above information is also available on the Company's website at www.optimusfinance.in

Kindly take the above information on your record.

Thanking you,

Yours faithfully,
For Optimus Finance Limited

Vruti Surti
Company Secretary & Compliance Officer

OPTIMUS FINANCE LIMITED

Bank of India VAPI MAIN : G.Floor, S.N. 1, 2 & 3 Fortune Chandra Nagri Apartment, Vapi-396 191, Contact: 0260-243165 Email: Vapi_surat@bankofindia.bank.in

BOI VAPI MAIN : G.Floor, S.N. 1, 2 & 3 Fortune Chandra Nagri Apartment, Vapi-396 191, Contact: 0260-243165 Email: Vapi_surat@bankofindia.bank.in

To, M/s Shree Krishna Textile Business/Factory/Unit Address At: Lalit Weaving Industries, C-1B, 706, 3rd Phase G.I.D.C., Umbergaon, Near Viral Corporation, Umbergaon, Gujarat-396171. **ALSO AT:** A & P.O. Bortai Via Valvada, Near: PTC College Ta: Umbergaon, Dist: Valsad-396191. **Mr. Pradeepsinh A. Chauhan** At & P.O. Bortai Via-Valvada, Near: PTC College, Ta: Umbergaon, Dist: Valsad-396191. **Mrs. Trupti N. Solanki** At & P.O. Bortai Via Valvada, Near: PTC College, Ta: Umbergaon, Dist: Valsad-396191. **Sir,** Notice U/s 13(2) Of The Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act 2002 1. At the request made by you, the Bank has granted you various credit limits for an aggregate amount of Rs. 32,00,000.00. We give hereunder details of various credit facilities granted by us and the amounts outstanding dues thereon as on the date of notice:

Nature of Facility	Sanctioned Limit(Rs.)	Outstanding dues(Rs.)
1. Cash Credit(Stocks)	5,00,000.00	2,39,187.80
2. Cash Credit(Bookdebts)	5,00,000.00	4,74,928.41
3. Term Loan	22,00,000.00	16,08,119.00
Total	32,00,000.00	23,22,235.21

2. The aforesaid credit facilities granted by the Bank are secured by the following assets/securities:

- Equitable Mortgage over Pardi No. 5/3, admeasuring 8 Guntha land land house NO-330, building construction area 2400.00 Sq. feets i.e. 223.04 sq. mtrs. (ground floor + one floor) situated at Village Bortai Taluka Umbergaon District-Valsad: Vapi, Dist: Valsad, Gujarat bounded by: East: Open Land, West: Fencing, III. South: Adjoining Property, IV. North: Main Road.
- Hypothecated Plant & Machinery with all accessories/equipments and tangible movable properties/Asscs belonging to you i.e.
- M/s Shree Krishna Textile Partner, D. Trupti N Solanki, C. Pradip Abhay Singh Chauhan
- As you have defaulted in repayment of your dues to the Bank under the said credit facilities, we have classified your account as Non-Performing Asset with effect from **30-06-2016** in accordance with the directions/guidelines issued by the Reserve Bank of India.
- For the reasons stated above, we hereby give you notice under Section 13(2) of the above noted Act and call upon you to discharge in full your liabilities by paying to the bank sum of **Rs. 23,22,235.21** along with Uncharged Interest and further interest thereon from **30-06-2016** compounded with monthly rests and all costs, charges and expenses incurred by the Bank till repayment by you within a period of 60 days from the date of this notice, failing which please note that we will entirely at your risks as to costs and consequences exercise the powers vested with the Bank under Section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, against the secured assets mentioned above.
- While we call upon you to discharge your liability as above by payment of the entire dues to the Bank together with applicable interest, all costs, charges and expenses incurred by the Bank till repayment and redeem the secured assets, within the period mentioned above, please take important note that as per section 13(8) of the SARFAESI act, the right of redemption of secured assets or inviting quotations or tender from public or private treaty for transfer by way of lease, assignment or sale of the secured assets.
- The amounts realized from exercising the powers mentioned above, will firstly be applied in payment of all costs, charges and expenses which are incurred by us and/or any expenses incidental thereto, and secondly in discharge of the Bank's dues as mentioned above with contractual interest from the date of this notice till the date of actual realization and the residue of the money, if any, after the Bank's entire dues (including under any of your other dues to the Bank whether as borrower or guarantor) are fully recovered, shall be paid to you.
- If the said dues are not fully recovered with the proceeds realized in the course of exercise of the powers against the secured assets, we reserve our right to proceed against you and your other assets including by filing legal/recovery actions before Debts Recovery Tribunal/Courts, for recovery of the balance amount due along with all costs etc. incidental thereto from you.
- Please take note that as per Sub-section (13) of the aforesaid Act, after receipt of this notice, you are restrained from transferring or creating any encumbrances on the aforesaid secured assets whether by way of sale, lease, license, gift, mortgage or otherwise.
- The undersigned is a duly authorized officer of the Bank to issue this notice and exercise powers under Section 13 of aforesaid act.
- Needless to mention that this notice is addressed to you without prejudice to any other right or remedy available to the Bank.

Date: 05.12.2025 | Place : Vapi | Authorised Officer, Bank of India.

:- PUBLIC NOTICE :-

Notice is hereby given to the Public that my client 1) SHRI UDAY NAROTTAMBHAI PRAJAPATI & 2) SHRI DHARMESH NAROTTAMBHAI PRAJAPATI, residing at Flat No. J-A/201, Park City, Amli, of the Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu - 396230, is absolute owner and possessor of the Industrial Gala No. 1, admeasuring 1406.53 Sq. Fts., equivalent to 130.62 Sq. Mtrs., constructed on the Ground Floor, of the building known as "SAI INDUSTRIAL ESTATE" situated at Non-Agricultural land bearing Survey No. 95 Paikae admeasuring 4000 Sq. Mtrs., Situated at Village Amli, in the Union Territory of the U.T. of Dadra and Nagar Haveli and Daman Diu

That 1) SHRI UDAY SHRI UDAY NAROTTAMBHAI PRAJAPATI & 2) SHRI & 2) SHRI DHARMESH NAROTTAMBHAI PRAJAPATI, had purchased the above said property/Gala from Shyamrao Ganpati Kumbharn, vide Sale Deed dated 14/03/2011, and the said Sale Deed registered with Sub-Registrar, Dadra and Nagar Haveli, Silvassa under Sr. No. 751/2011 on 14/03/2011, and Shyamrao Ganpati Kumbharn, had purchased the above said property/Gala from Mrs. Trathiya Kedar Naik, vide Sale Deed dated 05/01/2005, and the said Sale Deed registered with Sub-Registrar, Dadra and Nagar Haveli, Silvassa under Sr. No. 11/2005 Dated 05/01/2005 and Mrs. Trathiya Kedar Naik, had purchased the said property/Gala from Mohanlal Shankerlal Rawal, vide Sale Deed dated 26/11/2001, and the said Sale Deed registered with Sub-Registrar, Dadra and Nagar Haveli, Silvassa under Sr. No. 1341/2001 Dated 26/11/2001 and Mrs. Trathiya Kedar Naik, had purchased the said property/Gala from Mohanlal Shankerlal Rawal, vide Sale Deed dated 03/03/1994, and the said Sale Deed registered with Sub-Registrar, Dadra and Nagar Haveli, Silvassa under Sr. No. 184/1994 Dated 03/03/1994 and Mohanlal Shankerlal Rawal, had purchased the said property/Gala from M/s. Sai Enterprises. The original Sale Deed & registration receipt of said sale deed dated 03/03/1994 vide reg. Sr. No. 184/1994, original Sale Deed & Original registration receipt of said sale deed dated 26/11/2001 vide reg. Sr. No. 1341/2001, & original registration receipt of said sale deed dated 05/01/2005 vide reg. Sr. No. 11/2005, which were in 1) Shri Uday Narottambhai Prajapati & 2) Shri Dharmesh Narottambhai Prajapati's custody/Possession and said Original Sale Deed & Registration Receipt of said Sale Deed is lost by them at Amli, Silvassa. All person are hereby informed not to deal or carry out any transaction with anyone on the basis of the said missing documents. If anyone has already carried out or being carried out kindly inform the undersigned in writing on the below mentioned address within 7 days from this present.

THE SCHEDULE ABOVE REFERRED TO :-
(Description of the property)

All that piece and parcel of the Industrial Gala No. 1, admeasuring 1406.53 Sq. Fts., equivalent to 130.62 Sq. Mtrs., constructed on the Ground Floor, of the building known as "SAI INDUSTRIAL ESTATE" situated at Non-Agricultural land bearing Survey No. 95 Paikae admeasuring 4000 Sq. Mtrs., Situated at Village Amli, in the Union Territory of the U.T. of Dadra and Nagar Haveli and Daman Diu. U.T. : Silvassa - Date. : 09.04-2026

HITESH K. BHANDARI Advocate & Notary for Client
Office at : 239, 2nd Floor, Land Mark, Tokarkhada, Silvassa - 396 230, (UT of Dadra & Nagar Haveli) Mob. 98245 98844

OPTIMUS FINANCE LIMITED
CIN: L65910GJ1991PLC015044

Regd. Office: 301-304, Sears II, East Wing, Gotri-Sevasi Rd, Sevasi, Vadodara-391101, Gujarat, India. Phone No: (0265) 232 5321 • Website: www.optimusfinance.in • Email: info@optimusfinance.in

NOTICE TO THE SHAREHOLDERS
SPECIAL WINDOW FOR RE-LODGING OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES

Notice is hereby given that in terms of the SEBI circular no **HO/38/13/11(2)2026-IRSDPDD/3750/2026** dated January 30, 2026, another special window has been opened for transfer and dematerialisation of physical securities which were sold/purchased prior to April 01, 2019. The special window will remain open for a period of **one year from February 5, 2026 to February 4, 2027**. The special window shall also be available for such transfer requests which were submitted earlier and were rejected/returned/not attended, due to deficiency in the documents/process or otherwise.

Accordingly, eligible shareholders are requested to submit their transfer requests along with the requisite documents as mentioned in the aforesaid circular, to the Company's Registrar and Share Transfer Agent (RTA) - MUFJ Intime India Private Limited (formerly Link Intime India Private Limited). Please find their contact details below:
MUFJ Intime India Private Limited, "Geetakunj" 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara-390015. (Gujarat) India.
Tel.: (+91) (0265) 3566768
E-mail: investor.helpdesk@in.mpps.mufj.com
Website: https://in.mpps.mufj.com

The securities that are re-lodged for transfer shall be credited to the transferee only in demat mode and shall be under lock-in for a period of one year from the date of registration of transfer. Such securities shall not be transferred/lien-marked/pledged, during the said lock-in period.

For Optimus Finance Limited
Sd/-
Dipak V. Raval
(Whole Time Director)

Place: Vadodara
Date : 09.04.2026

PROTECTING INVESTING FINANCING ADVISING
Aditya Birla Housing Finance Ltd.

Registered Office: Indian Rayon Compound, Veraval, Gujarat 362266
Branch Office: Aditya Birla Housing Finance Limited, 3rd Floor, Office No. 203 To 211, Milestone Fiesta, Near Tgb Circle, L.P. Savani Road, Adajan, Surat- 395009

Notice
[Rule 8(6) & 9(1) of Security Interest (Enforcement) Rules 2002]
SALE BY PRIVATE TREATY OF IMMOVABLE ASSET CHARGED TO ADITYA BIRLA HOUSING FINANCE LIMITED UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002. ("SARFAESI ACT")

The undersigned being the Authorized Officer of Aditya Birla Housing Finance Limited (hereinafter referred to as "ABHFL") has taken the physical possession of the immovable property being "ALL THAT PIECE AND PARCEL OF PROPERTY KNOWN AS FLAT NO-102, FIRST FLOOR, HAVING LAND AREA 450 SQ.FT OR 41.82 SQ. MTRS. AND BUILDUP AREA 23.42 SQ. MTRS. OF WARD NO-10, NONDH NO-1801/B OF GOKUL RESIDENCY, CHAMPAGALLI, NAGAR SHETH PULLI, SONI FALYA IN SUB-DIST. & REGI. DIST. OF SURAT IN THE STATE OF GUJARAT AND BOUNDED AS BELOW: EAST: ROAD, WEST: LAGU PROPERTY, NORTH: WARD NO-10 & NONDH NO-1801/B, SOUTH: OPEN LAND (hereinafter referred to as "Secured Asset") under Section 13(4) of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as "SARFAESI Act, 2002") which is secured in favour of ABHFL towards financial facility, its outstanding dues of **INR 833588/- (Rupees Eight Lakhs Thirty Three Thousand Five Hundred Eighty Eight Only)** and further interest and other expenses incurred thereon till the date of realization to the Borrowers/Co-Borrowers - **NARESHBHAI MODI & NILESHKUMAR RAMANLAL BHATT**, (hereinafter referred to as "Borrowers/Co-Borrowers").

That on failure of the public auctions/e-auctions of Secured asset the undersigned is enforcing its security interest against the said Secured Asset by way of sale through private treaty under the provisions of SARFAESI Act, 2002 and Security Interest (Enforcement) Rules, 2002 (hereinafter referred to as "SARFAESI Act, 2002") which is secured in favour of ABHFL towards financial facility, its outstanding dues of **INR 833588/- (Rupees Eight Lakhs Thirty Three Thousand Five Hundred Eighty Eight Only)** and further interest and other expenses incurred thereon till the date of realization to the Borrowers/Co-Borrowers - **NARESHBHAI MODI & NILESHKUMAR RAMANLAL BHATT**, (hereinafter referred to as "Borrowers/Co-Borrowers").

That on failure of the public auctions/e-auctions of Secured asset the undersigned is enforcing its security interest against the said Secured Asset by way of sale through private treaty under the provisions of SARFAESI Act, 2002 and Security Interest (Enforcement) Rules, 2002 (hereinafter referred to as "SARFAESI Act, 2002") which is secured in favour of ABHFL towards financial facility, its outstanding dues of **INR 833588/- (Rupees Eight Lakhs Thirty Three Thousand Five Hundred Eighty Eight Only)** and further interest and other expenses incurred thereon till the date of realization to the Borrowers/Co-Borrowers - **NARESHBHAI MODI & NILESHKUMAR RAMANLAL BHATT**, (hereinafter referred to as "Borrowers/Co-Borrowers").

The Borrowers/Co-Borrowers are hereby informed that all the requisitions under the provisions of SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002 have been complied with, and ABHFL is now under the process of enforcing its security interest by effecting sale of the Secured Asset as mentioned herein by way of private treaty as prescribed under the provisions of Rule 8(5) of Security Interest (Enforcement) Rules, 2002. Further the Borrowers/Co-Borrowers attention is invited to provisions of sub-section (8) of Section 13 of SARFAESI Act, 2002 in respect of time available, to redeem the said Secured Asset.

Date: 10-04-2026
Place: SURAT
Authorised Officer
Aditya Birla Housing Finance Limited

NIDO HOME FINANCE LIMITED
(formerly known as Edelweiss Housing Finance Limited), having its office at: 5th Floor, Tower 3, Wing B, Kohinoor City Mall, Kohinoor City, Kirool Road, Kuria (W), Mumbai-400070. Branch Office: 302 to 304, 3rd eye vision, on 3rd floor, opp. Shivalki plaza, panjrapol-II road, Panjrapol, Ahmedabad-380009.

SALE OF IMMOVABLE PROPERTY UNDER PRIVATE TREATY

Sale Notice for sale of immovable property in exercise of the powers under the SARFAESI Act, 2002 and pursuant to the possession taken by the Authorized Officer under the said Act and Rules for recovery of the secured debts. We have received the offer of Rs. 7,77,000/- (Rupees Seven Lakh Seven Thousand Only) to purchase the said property under private treaty sale. Therefore, Authorized Officer has decided to sell the secured asset described herein under the private treaty.

Notice hereby is given to the public in general and in particular to the Borrower(s), Co-Borrower(s) and Guarantor(s) that the under mentioned property mortgaged in favour of Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited) (hereinafter referred to as "Nido") will be sold on "AS IS WHERE IS" - "AS IS WHAT IS" AND "WHATEVER THERE IS", condition, by way of "Private Treaty" for recovery of dues in terms of the provisions of SARFAESI Act read with Rules 8 (5) (d) & 9 of Security Interest (Enforcement) Rules, 2002. If in case, you have an offer for the said property for an amount over and above Rs. 7,77,000/- (Rupees Seven Lakh Seven Thousand Only) then same to be submitted to authorized officer within 15 days from the date of publication. If we do not receive any offer as mentioned herein above, we shall proceed with the said offer price of Rs. 7,77,000/- (Rupees Seven Lakh Seven Thousand Only) under Private Treaty sale as per the relevant provisions of the SARFAESI Act, 2002.

Sr.	Name and Address of the Borrower, Co-Borrower Guarantor and Loan Account No.	Details of the Secured Asset
1.	MEHULKUMAR KANTIBHAI NADAPARA (BORROWER) MANJULABEN KANTILAL NADAPARA (CO-BORROWER) Address: Flat No. G 3 Ground Floor Bhagavati Avenue Kamrej Under Mumbai Vitraj Co Op Hou Soc Surat 394185 Lan No.: LSRU0HL000090397	All That Piece And Parcel Of Property Bearing Flat No. G-3 On The Ground Floor Admeasuring 786 Sq. Fts. Super Built Up Area, & 43.81 Sq. Mts. Built Up Area, Along With Undivided Share In The Land Of "Bhagavati Avenue Of Mumbai Vitraj Co Op. Ho. Society Ltd.", Situate At Revenue Survey No. 374 & 376, Block No. 365 & 367 Totally Admeasuring 26280 Sq. Mts., Paiki Plot No. 23 & 24 Admeasuring 418.22 Sq. Mts., Of Moje Village Kamrej, Ta: Kamrej, Dist. Surat. Bounded As: Sale Deed:- North:- Khadi East:- Plot No. 25 West:- Plot No. 37 South:- Society Road.

Place: SURAT
Date: 10-04-2026
Sd/- Authorized Officer
For Nido Home Finance Limited, (Formerly Known As Edelweiss Housing Finance Limited)

NIDO HOME FINANCE LIMITED
(formerly known as Edelweiss Housing Finance Limited)
Registered Office Situated At Tower 3, 5th Floor, Wing 'B', Kohinoor City Mall, Kohinoor City, Kirool Road, Kuria (West), Mumbai - 400 070. Regional Office at: Office No. 302,303,304, 3rd Floor, 3rd Eye Vision Building, IIM - Panjrapole Road, Ahmedabad - 380015

POSSESSION NOTICE UNDER RULE 8(1) OF THE SARFAESI ACT, 2002

Whereas the Undersigned being the Authorized Officer of Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (order 3 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued Demand Notices to the Borrower/s as detailed hereunder, calling upon the respective Borrowers to repay the amount mentioned in the said notices with all costs, charges and expenses till actual date of payment within 60 days from the receipt of the same. The said Borrowers/Co-borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Co-borrowers and the public in general that the undersigned has taken symbolic possession of the property described hereunder in exercise of powers conferred on him under Section 13(4) of the said Act r/w Rule 8 of the said Rules in the dates mentioned along with the Borrowers in particular and public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of **Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited)**. For the amount specified therein with future interest, costs and charges from the respective dates.

Details of the Borrowers, Co-borrowers and Guarantors, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed thereunder and Date of Possession is given as under:

1. Name and Address of the Borrower, Co-Borrower Guarantor Loan Account No. And Loan Amount:-
PARASHBHAI DHARMESHKUMAR SHADHU (BORROWER) DHARMESHKUMAR RAMESHCHANDRA SADHU (CO-BORROWER) PADMANBHAI DHARMESHKUMAR SHADHU (CO-BORROWER) Resi Address: C S Ward No.1, C.S.No.2768 10 2768/11 And 2768 12 Paiky South Side, Parshvanath Apartment 3rd floor, Surendranagar 363001
LAN.NO. : L2250STHL00005338712 Loan Agreement Date: 30/04/2025
Rs. 21,98,530/- (Rupees Twenty One Lakh Ninety Eight Thousand Five Hundred Thirty Only) Demand Notice Date:- 19-12-2025
Amount Due In Rs. 23,00,403.21 (Rupees Twenty Three Lacs Four Hundred Threes & Twenty One paisa Only)
Constructive / Symbolic Possession Date: 09-04-2026

SCHEDULE OF THE PROPERTY:- All The Piece And Parcel Of The Immovable Property Being Surendranagar Municipal Corporation Limits At Parshvanath Apartment Situated At Surendranagar, Tal.: Wadhwan, Dist.: Surendranagar Bearing Surendranagar City Survey Ward No. 1, City Survey No. 2768/10, City Survey No. 2768/11 And City Survey No. 2768/12 Paiky South Part Total Sq. Meter 1149.32 Parshvanath Apartment Third Floor Flat No. 304 Admeasuring 72.36 Sq. Meter With The Ownership Of Pribhen Gangurabhai Raval And Bounded As Under:
North: Bounded By Flat No. 303 With A Common Wall And Common Passage. **South:** Bounded By Open Space Of Margin Thereafter City Survey No. 2746. **East:** Bounded By Open Space Of Margin Thereafter Road. **West:** Bounded By Flat No. 305 With A Common Wall And Space For Common Lift.

Place: SURENDRANAGAR
Date: 10-04-2026
Sd/- Authorized Officer
FOR Nido Home Finance Limited,
(formerly known as Edelweiss Housing Finance Limited)

Business Standard
CAMPUS TALK
PROMOTIONS

SPUMBA STUDENTS EXPLORE AMUL PRODUCTION

On March 24-25, 2026, students of the Postgraduate Department of Business Management visited the dairy management unit and chocolate factory of Amul in Anand. The visit was organized under the guidance of Director Dr Darshana Dave as part of the industrial exposure programme. The visit began with an overview of Amul's product portfolio and market presence, highlighting its strong positioning in the dairy industry. Participants observed key processes at the milk processing unit, including procurement, quality testing, pasteurisation, and automated packaging, with emphasis on hygiene and temperature control. They also gained insights into butter production, its quality standards, and packaging systems ensuring safety and consistency. At the chocolate factory in Mogar, students explored major stages of chocolate production along with essential quality checks. Overall, the visit provided practical exposure and deeper understanding of production, product management, and market-oriented operations.

Campus Reporter: Sakshi Singh

SUNDARKAND PATH AT SJPI-NICM

SJPI-NICM, in collaboration with Sundarkand Satsang Mandal Trust, organized a spiritually uplifting Sundarkand Path at the NICM Main Campus on 4th April, 2026. The event witnessed enthusiastic participation from a large number of students and faculty members, who came together in devotion and reverence. The collective recitation of the Sundarkand created a serene and positive atmosphere, fostering spiritual connection and inner peace among the attendees. The gathering reflected the institution's commitment to promoting cultural values alongside academic excellence. Participants engaged wholeheartedly in the prayers and rituals, experiencing a sense of unity and divine energy. The event concluded on a harmonious note, leaving everyone with a feeling of calmness, positivity, and spiritual fulfillment.

NEW VIP ROAD BRANCH VADODARA

APPENDIX - IV [See rule - 8(1)] POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, the Authorized officer of the Central Bank of India, NEW VIP ROAD, Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, and in exercise of powers conferred under Section 13 (1) & 13 (12) read with the Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice Dated 19.01.2026 calling upon the borrower Mr. Vankar Kalpeshbhai Parsottambhai & Co-borrower Mrs. Vankar Rekhaben Kalpeshbhai, to repay the amount mentioned in the notice being Rs. 30,29,007/- (Rupees Nine Lakh Nine Hundred Forty-Eight & Sixty Paise only) (which represents the principal plus interest due as on the 19.01.2026, plus interest and other charges from 19.01.2026 to till date within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to pay the entire dues of the bank, notice is hereby given to the borrower, the Guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13 (4) of the said act, read with Rule 8 of the Security Interest (Enforcement) Rule 2002 on this date 08.04.2026.

The borrower and the Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to charge of Central Bank of India, for the amount of Rs. 30,29,007/- (Rupees Nine Lakh Nine Hundred Forty-Eight & Sixty Paise only) (which represents the principal plus interest due on the 19.01.2026), plus interest and other charges from 19.01.2026.

The borrower's attention is invited to provisions of sub section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Immovable property bearing Unit/Flat no. 101 at 1st floor, Tower-D admeasuring area 78.99 sq mtr and other common undivided area 27.18 Sq. Mtr in the scheme namely "AKSHAR RESIDENCY" constructed on the land bearing R.S. No. 130 total admeasuring area 4350 sq mt in Mouje Village - Vadsar, In registration District Vadodara, and Sub District Vadodara. Near Diya Grand City Vadsar Road, Vadodara-390010. Bounded: East: Society Road, West: Common passage between flats, North: Common Stairs, South: Flat No. D/102.

Date: 08.04.2026- Place: Baroda
Authorised Officer, Central Bank Of India

NOTICE

MAGNUM SIF OFFERED BY SBI MUTUAL FUND

Half-Yearly Portfolio of the Investment Strategy of Magnum SIF (offered by SBI Mutual Fund) as on March 31, 2026

Notice is hereby given that in terms of applicable provisions of SEBI (Mutual Funds) Regulations, read with SEBI Master Circular for Mutual Funds, the half-yearly portfolio statement as on March 31, 2026 of the Investment Strategy of Magnum SIF (offered by SBI Mutual Fund) have been hosted on the website of Magnum SIF viz, <https://www.sbfm.com/magnumsif> and on the website of AMFI viz, www.amfiindia.com. Investors may accordingly view / download the portfolio statement from the above-mentioned websites.

Investors can also request for the physical or electronic copy of the statement of Investment Strategy portfolio through telephone (on 1st floor) on our Toll Free Nos. 1800 209 3333/1800 425 5425), 91-22-62511600 / +91-80-25512131 (outside India) email (customer.delight@sbfm.com) or by submitting written request at the nearest branch of SBI Funds Management Limited (the AMC). The list of branches of the AMC is available on www.sbfm.com.

For SBI Funds Management Limited
Sd/-
Nand Kishore
Managing Director & CEO

Place : Mumbai
Date : April 09, 2026

Asset Management Company: SBI Funds Management Limited (A Joint Venture between SBI & AMUNDI) (CIN: U65990MH1992PLC065289) **Trustee:** SBI Mutual Fund Trustee Company Pvt. Ltd. (CIN : U65991MH2003PTC138496) **Sponsor:** State Bank of India. **Regd Office:** 9th Floor, Crescenzoo, C - 38 & 39, G Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400051 **Tel:** 91-022-61793000 • **Fax:** 91-022-617425687 • **E-mail:** partnerforlife@sbfm.com • www.sbfm.com

Investments in Specialized Investment Fund involves relatively higher risk including potential loss of capital, liquidity risk and market volatility. Please read all investment strategy related documents carefully before making the investment decision

SBFMF/2026/APR/03

HDFC Bank Ltd.
We understand your world
Branch Address: HDFC House, Trident Complex, Race Course Vadodara 390007.
CIN L70100MH1977PLC019916 Website: www.hdfc.com

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

The Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC) issues Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) indicated in Column (A) that the below described immovable property(ies) described in Column (C) mortgaged/charged to the Secured Creditor, the constructive / physical possession of which has been taken as described in column (D) by the Authorised Officer of HDFC Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as per the details mentioned below :

Notice is hereby given to Borrower / Mortgagee(s) / legal heirs, legal representatives (whether known or unknown), executor(s), administrator(s), successor(s) and assign(s) of the respective Borrower(s) / Mortgagee(s) (since deceased), as the case may be, indicated in Column (A) under Rule 8(6) of the Security Interest (Enforcement) Rules 2002. For detailed terms and conditions of the sale, please refer to the link provided in HDFC Secured Creditor's website i.e. www.HDFCBANK.COM

SR NO	Name/s of Borrower(s)/ Mortgagee(s)/ Guarantor(s)/ Legal Heirs and Legal Representatives (whether known or unknown) Executor(s), Administrator(s), Successor(s) and Assign(s) of the respective Borrower(s) / Mortgagee(s) / Guarantor(s) (since deceased), as the case may be.	Outstanding dues to be recovered (Secured Debt) (Rs.)*	Description of the Immovable Property / Secured Asset (1 Sq. mtr. is equivalent to 10.76 Sq.ft)	Type of Possession	Reserve Price (Rs.)	Earnest money deposit (Rs.)	Date of Auction and time
	A	B	C	D	E	F	G
1	Mr. SALAKIYA JAYESHKUMAR RAMESHCHANDRA (BORROWER) Mrs. SALAKIYA HINA JAYESHKUMAR (CO-BORROWER)	RS. 35,69,219/- as on 30/04/2024	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY SITUATED AT FLAT B-603, FLOOR-5, SAHAJ FLORENCE- TOWER B, PLOT 38, S NO 408, B/H ST. BASIL SCHOOL, OPP.AATMIYA HARRITAGE, JAMBUDA, VADODARA - 390014. ADMEASURING SUPER BUILT UP AREA 127.74 SQ MTRS	PHYSICAL	Rs. 38,40,000/-	Rs. 3,84,000/-	13-MAY-2026 11:00 AM TO 12.30 PM
2	MR SADHU RAHUL DHARMENDRABHAI (BORROWER) MRS SADHU MEENABEN DHARMENDRA (CO-BORROWER)	Rs. 22,67,690/- as on 28-Feb-25	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY SITUATED AT FLAT-603, FLOOR-6 LILLERIA SIGNATURE-TOWER F S NO 973, 974, 975, FP-86, TP-80, NR. GOTRI LAKE, B/H BRAND FACTORY, GOTRI SEVASI ROAD, B/H ALANG HOUSE, VADODARA - 390021 ADMEASURING SUPER BUILT UP AREA 96.80 SQ MTRS	PHYSICAL	Rs. 20,85,000/-	Rs. 2,08,500/-	13-MAY-2026 11:00 AM TO 12.30 PM
3	MRS DHAVAN AMITA BADAL (BORROWER) MR BADAL JAYKUMAR DHAVAN (GUARANTOR)	RS. 22,26,587/- as on 31-Mar-25	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEING FLAT- 406, FLOOR-4,SHIV VILLA RESIDENCY,PLOT AA/15, AA/16, AA/17, S NO. 737, 743, NR. DARSHANAM UPVAN,B/H VAIKUNTH 1, B/H SHRI AMBE SCHOOL, WAGHODIA ROAD, VADODARA - 390019, ADMEASURING PLOT AREA APPROX. 121.23 SQ MTR	PHYSICAL	Rs. 22,80,000/-	Rs. 2,28,000/-	13-MAY-2026 11:00 AM TO 12.30 PM
4	MR. SINH RAJESHKUMAR B (BORROWER) MR. RAJPUT PARTIBHA RAJESH SINGH (CO-BORROWER)	Rs. 12,14,072/- AS ON 31-JUL-24	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE COMMERCIAL PROPERTY BEING C/22, NEMINATH HSG SOCIETY, R.S.475, BLOCK NO 357, OPP.BANCO COMPANY, ATLADARA TO PADRA ROAD, VILLAGE-BILL, VADODARA 390012, ADMEASURING SUPER BUILD UP AREA APPROX. 29.00 SQ MTR	PHYSICAL	Rs. 10,20,000/-	Rs. 1,02,000/-	13-MAY-2026 11:00 AM TO 12.30 PM
5	MRS SOLANKI MANJULABEN KALIDAS (BORROWER)	Rs. 15,71,348/- as on 31-Aug-24	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY SITUATED AT UNIT-119,FLOOR-1,BALAJI VIHAR,FP 966, TP 3, B/H MAHESH COMPLEX, NR SWIMMING POOL,WAGHODIA ROAD, VADODARA - 390019 ADMEASURING SUPER BUILT UP APPROX. 65.00 SQ MTR	PHYSICAL	Rs. 7,80,000/-	Rs. 78,000/-	13-MAY-2026 11:00 AM TO 12.30 PM

* together with further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred up to the date of payment and/or realisation thereof.
The Authorized Officer shall not be responsible for any error, misstatement or omission on the said particulars. The bidders are therefore requested in their own interest, to satisfy themselves with regard to the above and all other relevant details/material facts and information pertaining to the above mentioned immovable properties/secured assets before submitting bids. Statutory dues like property taxes/cass and transfer charges, arrears of electricity dues, arrears of water charges, sundry creditors, vendors, suppliers and other charges known and unknown, shall be ascertained by the bidder beforehand and the payment of the same be the responsibility of the buyer of Property/Secured Asset. Wherever applicable, it is the responsibility of buyer of Secured Assets to deduct tax at source (TDS) @ of 1% of the total sale consideration on behalf of the resident owner (seller) on the transfer of immovable property having consideration equal to Rs. 50 Lacs and above and deposit the same with appropriate authority u/s 194 I/A of Income Tax Act.

Disclosure of Encumbrances
The best of the knowledge and information of the Authorised Officer of HDFC Bank Limited, there are no encumbrances in respect of the above immovable properties/secured assets.

Most Important Terms and Conditions

- BID INCREMENT AMOUNT FOR THE PROPERTIES/SECURED ASSETS MENTIONED AT SR NO 4 AND 5 WOULD BE RS. 10,000/- (RUPEES TEN THOUSAND ONLY) AND MENTIONED AT SR NO 1, 2 AND 3 WOULD BE RS. 25,000/- (RUPEES TWENTY FIVE THOUSAND ONLY).
- SECURED ASSETS ARE AVAILABLE FOR INSPECTION ON 15-APR-2026 BETWEEN 10:00 AM TO 4:00 PM.
- E-Auction Bid Document can be obtained on-line from the website <https://eauctions.sanil.in> or can be obtained at HDFC House, Trident Complex, Race course circle Vadodara -390009
- For any assistance related to inspection of the property, or for obtaining the E-Auction Bid Document and for any other queries, please get in touch with our authorized Service Provider M/s. Share Ram Automall Pvt. Ltd, through its concerned person Mr. Shishir Zala through their centralized Mobile No. 8238038189 or Mr. Rahul Adnan Vatturkar, Mob No. 9601795347 or HDFC Bank Limited through Headrick Pandya Mobile no. 7228971677
- THE LATEST DATE OF SUBMISSION OF BIDS IN PRE

ભારત તેની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે પ્રયત્નશીલ ઘટાં પણ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે

ભારતને ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજોમાં વૈવિધ્યીકરણમાં પડકારો

૨૦૨૬ પહેલાંના તેમના જથ્થાબંધ એલપીજી વપરાશના ૭૦% પ્રાપ્ત થશે

અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઊર્જાના નવા સ્ત્રોતો અને મહત્વપૂર્ણ ખનિજો તરફ ઝડપી વધારો

નવી દિલ્હી, તા. ૯
ભારત ભવિષ્ય માટે તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઊર્જાના નવા સ્ત્રોતો અને મહત્વપૂર્ણ ખનિજો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે, જ્યારે આ વૈવિધ્યકરણ દેશ માટે મહત્વપૂર્ણ છે, ત્યારે તેણે કેટલાક નવા પડકારોને પણ જન્મ આપ્યો છે. ગુરુવારે ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન લીડરશીપ કોફેલેવને સંબોધતા, ટાટા સ્ટીલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને ભારતના ઔદ્યોગિક વલણને બહુ-સ્તરીય જોખમ ગણાવ્યું.



ટ્યારે પુરવઠા શુંબલામાં ઉભરી રહેલા નવા જોખમોને સમજવું જરૂરી છે. નરેન્દ્રને કહ્યું કે ભારત માટે ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજ સ્ત્રોતોનું વૈવિધ્યકરણ જરૂરી છે, પરંતુ તેમાં રહેલી જટિલતાઓને અવગણી શકાય નહીં. તેમણે કહ્યું, “પડકાર સ્પષ્ટ

જે આ આયાતોને આપણા દેશમાં સરળતાથી પહોંચાડે છે.” નરેન્દ્રના મતે, આ દાયકાની શરૂઆતમાં કોવિડ-૧૯ રોગચાળો એક મોટો વિશ્લેષ હતો, જેના કારણે સરકારોને ઝડપથી કાર્ય કરવાની ફરજ પડી અને વ્યવસાયો અને સમાજને કામ કરવાની નવી રીતો અપનાવવા માટે પ્રેરિત કર્યાં. આપણે પણ, અનેક વૈશ્વિક આંચકા આચ્છા છે. નરેન્દ્રને સમજાવ્યું કે તુટેલી વૈશ્વિક પુરવઠા શુંબલા, રશિયા-યુક્રેન સંઘર્ષ, ઊર્જા અને કોમોડિટી બજારોમાં નોંધપાત્ર અસ્થિરતા, વધતા વેપાર અવરોધો, કડક ટેકનોલોજી નિયંત્રણો અને તાજેતરમાં પશ્ચિમ એશિયા કટોકટીને કારણે મુખ્ય શિપિંગ માર્ગોમાં વિશ્લેષોએ વિશ્વની વેપાર ગતિશીલતા બદલી નાખી છે. AIMA ના પ્રમુખ તરીકે બોલતા, નરેન્દ્રને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કટોકટી વચ્ચે ભારત માટે એક વિશાળ તક રહેલી છે. વિશ્વ હાલમાં એક વિશ્વસનીય ભાગીદાર, વૈવિધ્યસભર સહાય થઈ ન અને સ્થિર વૃદ્ધિ સાથે બજાર શીટ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “ભારત માટે તક ફક્ત આપણી પોતાની જરૂરિયાતો માટે ઉત્પાદન કરવાની જ નહીં, પણ વિશ્વને વેચવાની પણ છે. વાસ્તવિક કસોટી એ છે કે આપણે આમ કરવામાં કેટલા સક્ષમ સાબિત થઈએ છીએ.” ભારત હાલમાં તેની ઊર્જા સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે મોટાપાયે સૌર, ધન, જળવિદ્યુત, પરમાણુ, જૈવ ઇંધન, ગેસ અને ગ્રીન-હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે.

નવી દિલ્હી, તા. ૯
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ પુરવઠાની બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે ઔદ્યોગિક વપરાશ માટે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સતત અને સ્થિર રીતે ઉપલબ્ધ થતો રહે તેની ખાતરી કરવા માટે એક આદેશ બહાર પાડ્યો છે. એમઓપીએનજીના સચિવ ડૉ. નીરજ મિતલે ભારત સરકારના તમામ સચિવો અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ફામાં, ફૂડ પ્રોસેસિંગ, પોલીમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, મેટલ, સિરામિક, ગ્લાસ, હેરોસોલ, ફાઉન્ડ્રી, ફોર્જિંગ, ડેલી વોટર, યુરેનિયમ અને સીડ સેક્ટરના ઔદ્યોગિક એકમોને માર્ચ ૨૦૨૬ પહેલાંના તેમના જથ્થાબંધ એલપીજી

વપરાશના ૭૦% પ્રાપ્ત થશે, જે પ્રતિદિન ૦.૨ ટીએમટીની એકંદર ક્ષેત્રીય ટોચમર્યાદાને આધીન રહેશે. તે ૧૬થી ૨૭ માર્ચ વચ્ચે થયેલા સંચાર પર આધારિત છે, જેમાં વધારાના ૧૦% પાર્શ્વ નેચરલ ગેસ (પીએનજી) સુધારણાના સીમાચિહ્નો સાથે જોડાયેલા છે. આ અભિગમ વૈકલ્પિક ઈંધણના આંતરમાળખાં પર કડકિત રીતે પરિવર્તિત થવાને પ્રોત્સાહન આપવાની સાથે એલપીજીના પ્રમાણબદ્ધ વિતરણની ખાતરી કરે છે. એમઓપીએનજીએ વધુમાં જણાવ્યું હતું કે, જે ઊદ્યોગોની ઉત્પાદનપ્રક્રિયામાં એલપીજી એક મહત્વપૂર્ણ અને બિન-વૈકલ્પિક ઈંધન પુરવઠા તરીકે ઉપયોગમાં લેવાય છે, તેમને ફાળવણીમાં આંતરિક પ્રાથમિકતા આપવામાં આવશે. આ પ્રકારના ક્ષેત્રો માટે પીએનજી કનેક્ટિવિટી માટે અરજી કરવાની જરૂરિયાત ૨૬ કરવામાં આવી છે, જે નિર્ધારિત શરતોનું પાલન કરવાની સાથે ઔદ્યોગિક કામગીરી પર કોઈ અસર ન થાય તેની ખાતરી કરે છે. મંત્રાલયે જે ઊદ્યોગો ઈંધણ તરીકે એલપીજીનો ઉપયોગ કરે છે અને સમય જતાં પીએનજી પર પરિવર્તિત થઈ શકે છે તથા જે ઊદ્યોગો માટે એલપીજી ઉત્પાદન માટેનું એક અનિવાર્ય ઈનપુટ છે, તે બંને વચ્ચે સ્પષ્ટ તફાવત પણ દર્શાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ યુરીનેએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ક્રિમિતોમાં નોંધપાત્ર અસ્થિરતા હોવા છતાં સ્થાનિક સ્તરે એલપીજીનો સ્થિર પુરવઠો ઉપલબ્ધ થતો રહે તેની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બિઝનેસ આજકાલ

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની, પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રના વિરાણકર્તાઓ પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન બે આંકડામાં લોન વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે થાપણ વૃદ્ધિ ધીમી પડી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા લોન વાર્ષિક ધોરણે ૧૨.૧૭ ટકા વધીને ૩૧.૧૯૬ લાખ કરોડ થઈ, જ્યારે થાપણ વાર્ષિક ધોરણે ૧.૮૮ ટકા વધીને ૩૧.૧૬૫ લાખ કરોડ થઈ હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લોન વાર્ષિક ધોરણે ૧૩.૭૮ ટકા વધીને ૩૧.૬૮૬ લાખ કરોડ થઈ હતી, જ્યારે થાપણો ૧૩.૪૮ ટકા વધીને ૩૧.૬૮૬ લાખ કરોડ થઈ છે. બેંકની લોન ૨૭ ટકા વધીને ૩.૪૦, ૩૬.૪૮ કરોડ થઈ હતી.

એફએમસીજીના ઘરઆંગણે વેચાણમાં ૮થી ૯ ટકા વૃદ્ધિ થયાનો અંદાજ

મુંબઈ: સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ ના ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની ફાસ્ટ મુવિંગ કન્સ્યુમર ગુડ્સ (એફએમસીજી) કંપનીઓ પર ઈરાન યુદ્ધની અસર પડી છે, પરંતુ ઘરઆંગણે સારા વેપારને કારણે વિદેશમાં મંદ વેચાણની અસર હળવી થઈ શકી છે. યુદ્ધ લાંબુ ચાલશે તો નવા નાણાં વર્ષમાં ઉત્પાદન ખોરવાઈ જવાની ચિંતા રહેલી છે. સ્થિર બુદ્ધિ આર્થિક વાતાવરણને કારણે એફએમસીજી કંપનીઓ માટે માર્ચ ત્રિમાસિકમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહી છે. માર્ચ ત્રિમાસિકમાં એફએમસીજીના ઘરઆંગણે વેચાણમાં ૮થી ૯ ટકા વૃદ્ધિ થયાનો અંદાજ મુકાઈ રહ્યો છે. બજારમાં વેચાણમાં ઘટાડાની અસર ધોવાઈ ગઈ હતી.

દેશના સોનાના ભંડારનું મૂલ્ય ૩.૬૬૬ ઘટીને ૧૧૩.૫૨૧ બિલિયન ડોલર થયું

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ૨૭ માર્ચના રોજ પૂરા થયેલા સમાહમાં દેશનું વિદેશી હુડિયામણ અનામત ૧૦.૨૮ બિલિયન ડોલર ઘટીને ૬૮૮.૦૫ બિલિયન ડોલર થયું છે. પાછલા સમાહમાં પણ ૧૧.૪૧ બિલિયન ડોલર નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી હુડિયામણ અનામતમાં સતત બીજા સમાહમાં ઘટાડો થયો છે, વિદેશી હુડિયામણ અનામત ૨૭ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સમાહમાં ૭૨.૮૮૪ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તે ઘટી રહ્યું છે. ડેટા અનુસાર, આ ઘટાડા માટે સૌથી મોટો ફાળો વિદેશી ચલણ સંપત્તિમાં ઘટાડો હતો.

ઘટના બની તે સ્થળ ઉપર કોઈ સીસીટીવી કેમેરા પણ લાગેલા નથી

નર્મદા પરિક્રમામાં ફરજ પર રહેલા યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત

ઢાળ ઉપર બનાવેલા પગથિયાંની લોખંડની ઍંગલ યુવાનના મોતનું કારણ?

રાજપીપળા, તા. ૯
પહેલી એપ્રિલ ૨૦૨૬ ની રાત્રે નર્મદા જિલ્લાના નવા વાઘપુરા ગામના ભાવેશભાઈ વસાવા પોતાના ખાનગી વાહન સાથે નર્મદા પંચકોશી પરિક્રમામાં ફરજ ઉપર રહેલા મત્સ્ય વિભાગના અધિકારી સાથે પોતાના કોન્ટ્રાક્ટ ઉપર રાખેલ મારુતિ આર્ટિગા કાર સાથે હાજર હતા. જ્યાં તેમનું રહસ્યમય સંજોગોમાં મરણની ઘટના પ્રકાશમાં આવી છે.



અધિકારીને ડ્રોપ કર્યા બાદ તેઓ કાર પાર્કિંગ તરફથી નદી કિનારેથી ચાલતા ચાલતા જતા હતા ત્યાં વચ્ચે પરિક્રમા માટે બનાવવામાં આવેલા

હંગામી પગથિયાઓ ઉપર મરણ હાલતમાં મળી આવતા રાત્રિના સમયે નજીકમાં રહેલા પોલીસ કર્મી દ્વારા આ યુવકના પિતાને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. મરણ જનાર યુવકના પિતાના જણાવ્યા મુજબ તેઓ જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે તેમનો દીકરો મરણ પામેલી હાલતમાં સ્થળ ઉપર હતો અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન હતા. ત્યારબાદ મરેલા યુવકને એમ્બ્યુલન્સ મારફતે મરડે સુધર પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો અંતિમ સંસ્કાર કરી દેવાયું હતું. ભાવેશના પિતાના જણાવ્યા મુજબ તેમના દ્વારા

પોલીસને આ મામલે જાણવાજોગ નિવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ આ નિવેદન પોલીસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી તેમજ જે ઘટના બની તે સ્થળ ઉપર કોઈ સીસીટીવી કેમેરા પણ લાગેલા નથી જેથી મોતનું સાચું કારણ શું છે તે અંગે તેઓ પણ આશંકામાં છે માટે તેમણે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માંગણી કરી છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ જે પગથિયાં બનાવેલા છે ત્યાં મારવામાં આવેલી લોખંડની ઍંગલ યુવકના ગળાના ભાગે આટલી ગંભીર રીતે કેવી રીતે વાગી શકે જેનાથી મોત થયું આ મામલે પણ તેઓ શંકાશીલ



ભરૂચ, તા. ૯
આગામી ૨૬ એપ્રિલે યોજાનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં

ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ ઓફિસરોને તાલીમ વર્ગ

વહીવટી તંત્ર દ્વારા તેયારીઓ તેજ બનાવી દેવામાં આવી છે. તેના ભાગરૂપે સરકારી એન્જિનિયરિંગ કોલેજ, ભરૂચ માટે પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમ બે તબક્કામાં યોજાયો હતો, જેમાં અંદાજિત ૬૦૦ જેટલા પોલિંગ ઓફિસરોને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોએ ભાગ લીધો હતો. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય

તેમજ મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીઓને વ્યાપક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી ચૂંટણી સંબંધિત ક્ષતિરહિત માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોલિંગ ઓફિસરોને બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જોડણ, સીલિંગ પ્રક્રિયા અને મોકપોલ અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું

હતું. તે ઉપરાંત મતદારોની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયા, મતદાર રજિસ્ટર સંભાળવાની જવાબદારી જેવા મહત્વના મથકે થતી તમામ કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈવીએમ મશીનના ઉપયોગ અંગે લાઈવ ડેમો દ્વારા પણ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલિંગ ઓફિસરોના પ્રશ્નો અને મૂંઝવણોનું તજજ્ઞો દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મદદનિશ ચૂંટણી અધિકારી, મામલતદાર, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

હેરણના ભાડામાં ઝગડો થતા પત્નીએ પતિને માથામાં પથ્થરમારી હત્યા કરી

રાજપીપળા, તા. ૯
મધ્યપ્રદેશ અલીવારજપુર ના મૂળ રહીશ ઈપતી વોરા ગામમાં થી શાકભાજી લઈ પિતાના ડેરહાણ તરફ રાત્રીના જતા હતા જેમાં વચ્ચે બંને વચ્ચે ઝગડો થતા પત્નીએ પતિને માથામાં પથ્થરમારી હત્યા કરી પોલીસે પત્નીની ધરપકડ કરી પ્રેમ માહિતી અનુસાર મધ્યપ્રદેશ અલીવારજપુરના કોંસારી

ગામના મૂળ રહીશ અને હાલ તિલકવાડા ના તેડીયા સાહેબપુરા ખાતે છાપરું બનાવી રહેતા હતા તે છૂટક મજૂરી કરતા હતા. ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં વોરાસીમ હનુમંતેશ્વર મંદિરની પાછળ હેરણનદીના ભાડા માંથી ૨૪ વર્ષીય અરવિંદ રણસિંહ નાયક તથા તેની ૩૨ વર્ષીય પત્ની રેખા નાયક બંને વોરા ગામમાંથી શાકભાજી લઈ હેરણ નદીના

ભાડામાં ચીલા વાટે થઈને તેમના રહેણાંક છાપરા પર મોજે તેડીયા સાહેબપુરા ચાલતા જઈ રહેલ હતા ત્યારે વોરા સીમ હનુમંતેશ્વર મંદિરની પાછળ હેરણનદીના ભાડામાં આવતા પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થઈ હતી. પતિ એ તેની પત્ની ને “ તારે મારી સાથે નથી રહેવાનું, તારે જ્યાં રહેવું હોય ત્યા જતી રે” તેમ જણાવી ગાલ પર બે તમાચા મારતા

પત્નીને ગુસ્સો આવતા હેરણનદીના પટમાં પથ્થર હાથમા પકડી પતિ ને મારી નાખવાના ઈરાદા સાથે માથાના ભાગે જમણી બાજુ મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું. આ બાબતે પોલીસ ને જાણ થતા તિલકવાડા પી.આઈ એ.પી.મોલક્રી ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
Central Bank of India
CENTRAL TO YOU SINCE 1911

ન્યુ વી.આઈ.પી. રોડ શાખા, વડોદરા

APPENDIX - IV [See rule - 8(1)]
કબજ અંગેની નોટિસ
(FOR IMMOVABLE PROPERTY)

આથી નીચે સહી કરનાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ન્યુ વી.આઈ.પી. રોડ શાખા ના અધિકૃત અધિકારીએ સિમ્લોરિટાઈઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ક્ષયાભવિત એસ્ટેટ એન્ડ એન્વોસિમેન્ટ ઓફ સિમ્લોરિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ હેઠળ અને સિમ્લોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્વોસિમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના રૂલ્સ ૩ સાથે યાંચતા સેક્શન ૧૩(૨) અને ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત થયેલ સત્તાની રૂબરૂ ફરજદાર શ્રી વણકર કલ્પેશભાઈ પરસોત્તમભાઈ અને સહ -ફરજદાર શ્રીમતી વણકર રેખાબેન કલ્પેશભાઈ ને ડીમાન્ડ નોટિસ તા: ૧૯.૦૧.૨૦૨૬ ના રોજ પાઠવીને નોટિસમાં દર્શાવેલ રકમ રૂ. ૩૦,૨૬,૦૦૭/- (અંકે રૂ. ત્રીસ લાખ ઓગણત્રીસ હજાર સાત પુરા) (જે ૧૯/૦૧/૨૦૨૬ ના રોજ મુદત વતા વ્યાજનું પ્રતિનિધિત્વ કરે છે.) પસ વ્યાજ અને અન્ય ખર્ચ તા ૧૩.૦૧.૨૦૨૬ થી આજની તારીખ સુધી આ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંત ભરપાઈ કરવા જણાવવામાં આવેલ છે.

ફરજદારો રકમ ચુકવે કરવામાં નિષ્ફળ ગયા હોય, આથી ફરજદારો, જામીનદાર અને જાહેર જનતાને નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે, નીચે સહી કરનાર ઉપરોક્ત અધિનિયમના હવાલે ૮ સીસ્ટીરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્વોસિમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ સાથે યાંચતા સેક્શન ૧૩(૧) ની અનુચ્છે પ્રાપ્ત અધિકારોની રૂબરૂ નીચે દર્શાવેલ વિસ્તૃત મુજબ મિલકતનો સાહેબિત કબજો તારીખ: ૦૮.૦૪.૨૦૨૬ ના રોજ લઈ લીધેલ છે.

ફરજદારો અને જામીનદાર તથા જાહેર જનતાને સહ મિલકત સંબંધે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા વેતપાલી આપવામાં આવે છે તેમજ જો કોઈ પણ વ્યવહાર કરશે તો સહ વ્યવહાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની રકમ રૂ. ૩૦,૨૬,૦૦૭/- (અંકે રૂ. ત્રીસ લાખ ઓગણત્રીસ હજાર સાત પુરા) (જે ૧૯/૦૧/૨૦૨૬ ના રોજ મુદત વતા વ્યાજનું પ્રતિનિધિત્વ કરે છે.) પસ વ્યાજ અને અન્ય ખર્ચ તા ૧૩.૦૧.૨૦૨૬ થી આજની તારીખ સુધી આ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંત ભરપાઈ કરવા જણાવવામાં આવેલ છે.

સિમ્લોરિટી મિલકત હોવાવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત સરકારી એજન્ડા સેક્શન (૧૩) ના સબ-સેક્શન (૨) ની જોવાઈ તરફ ફરજદારો નું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાયિત મિલકત નું વર્ણન

સ્થાયિત મિલકતનું સંપૂર્ણ વિગતવાર વર્ણન જમીન અને સિલિંગ અને માહિતીના દસ્તાવેજની વિગતો તેની સીઆએ સાથે -જીલ્લો વડોદરા સબ જીલ્લો વડોદરા મોજે દર્શાવેલ આર.એસ. નં. ૨૬૬/૧/બી. સી. એસ. નં. ૫૮૫ સેક્ટરન ૬૫૪૪ ચોરસ મીટર જમીન જે 'શુભલક્ષી નિવાસસ્થાન' એપાર્ટમેન્ટ ના બીજો માળ ફલેટ નં. એ-૨૦૪ સેક્ટરન ૪૩ ચોરસ મીટર જેનો પ્રમાણસર હિસ્સો ની જમીન ની એપાર્ટમેન્ટ સેક્ટરન ૪૩.૪૫ ચોરસ મીટર. યુ.ઈ.સી. મોજે ફલેટ નં. એ૨૦૩, પશ્ચિમ: ફલેટ નં ૧૦૩, ઉત્તર: કોમન રોકાસ, ઉત્તર: કોમન પેસેજ લીફ્ટ અને એ૨૦૧, દક્ષિણ: ઓપન ગ્રેડ ર.૪૫

તા: ૦૮.૦૪.૨૦૨૬ -સ્થાયિત વડોદરા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
Central Bank of India
CENTRAL TO YOU SINCE 1911

રેસકોર્ડ રોડ શાખા, વડોદરા
મો. ૦૯૮૯૧૩૬૬૬

APPENDIX - IV [See rule - 8(1)]
કબજ અંગેની નોટિસ
(FOR IMMOVABLE PROPERTY)

આથી નીચે સહી કરનાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, રેસકોર્ડ રોડ શાખા ના અધિકૃત અધિકારીએ સિમ્લોરિટાઈઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ક્ષયાભવિત એસ્ટેટ એન્ડ એન્વોસિમેન્ટ ઓફ સિમ્લોરિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ હેઠળ અને સિમ્લોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્વોસિમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના રૂલ્સ ૩ સાથે યાંચતા સેક્શન ૧૩(૨) અને ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત થયેલ સત્તાની રૂબરૂ ફરજદાર શ્રી સુરેશ કુમાર જે ભગવાન સહાય ના પુત્ર અને સહ -ફરજદાર શ્રીમતી સુખમ દેવી જે સુરેશ કુમાર સહાય ના પત્ની ને ડીમાન્ડ નોટિસ તા: ૧૩.૦૧.૨૦૨૬ ના રોજ પાઠવીને નોટિસમાં દર્શાવેલ રકમ રૂ. ૧૨,૦૮,૭૪૬.૭૩ (અંકે રૂ. બાર લાખ અઠસર સાતસો છેતાલીસ અને તોરેર પેસા પુરા) (જે ૧૩.૦૧.૨૦૨૬ ના રોજ મુદત વતા વ્યાજનું પ્રતિનિધિત્વ કરે છે.) પસ વ્યાજ અને અન્ય ખર્ચ તા ૧૩.૦૧.૨૦૨૬ થી આજની તારીખ સુધી આ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંત ભરપાઈ કરવા જણાવવામાં આવેલ છે.

ફરજદારો રકમ ચુકવે કરવામાં નિષ્ફળ ગયા હોય, આથી ફરજદારો, જામીનદાર અને જાહેર જનતાને નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે, નીચે સહી કરનાર ઉપરોક્ત અધિનિયમના હવાલે ૮ સીસ્ટીરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્વોસિમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ સાથે યાંચતા સેક્શન ૧૩(૧) ની અનુચ્છે પ્રાપ્ત અધિકારોની રૂબરૂ નીચે દર્શાવેલ વિસ્તૃત મુજબ મિલકતનો સાહેબિત કબજો તારીખ: ૦૬.૦૪.૨૦૨૬ ના રોજ લઈ લીધેલ છે.

ફરજદારો અને જામીનદાર તથા જાહેર જનતાને સહ મિલકત સંબંધે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા વેતપાલી આપવામાં આવે છે તેમજ જો કોઈ પણ વ્યવહાર કરશે તો સહ વ્યવહાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની રકમ રૂ. ૧૨,૦૮,૭૪૬.૭૩ (અંકે રૂ. બાર લાખ અઠસર સાતસો પેસા પુરા) (જે ૧૩.૦૧.૨૦૨૬ ના રોજ મુદત વતા વ્યાજનું પ્રતિનિધિત્વ કરે છે.) પસ વ્યાજ અને અન્ય ખર્ચ તા ૧૩.૦૧.૨૦૨૬ થી આજની તારીખ સુધી આ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંત ભરપાઈ કરવા જણાવવામાં આવેલ છે.

સ્થાયિત મિલકત નું વર્ણન

સ્થાયિત મિલકતનું સંપૂર્ણ વિગતવાર વર્ણન જમીન અને સિલિંગ અને માહિતીના દસ્તાવેજની વિગતો તેની સીઆએ સાથે -જીલ્લો વડોદરા સબ જીલ્લો વડોદરા મોજે દર્શાવેલ આર.એસ. નં. ૨૬૬/૧/બી. સી. એસ. નં. ૫૮૫ સેક્ટરન ૬૫૪૪ ચોરસ મીટર જમીન જે 'શુભલક્ષી નિવાસસ્થાન' એપાર્ટમેન્ટ ના બીજો માળ ફલેટ નં. એ-૨૦૪ સેક્ટરન ૪૩ ચોરસ મીટર જેનો પ્રમાણસર હિસ્સો ની જમીન ની એપાર્ટમેન્ટ સેક્ટરન ૪૩.૪૫ ચોરસ મીટર. યુ.ઈ.સી. મોજે ફલેટ નં. એ૨૦૩, પશ્ચિમ: ફલેટ નં ૧૦૩, ઉત્તર: કોમન રોકાસ, ઉત્તર: કોમન પેસેજ લીફ્ટ અને એ૨૦૧, દક્ષિણ: ઓપન ગ્રેડ ર.૪૫

તા: ૦૮.૦૪.૨૦૨૬ -સ્થાયિત વડોદરા

જાહેર નોટિસ

આથી અમે વિજયકુમાર બી. પ્રજાપતિ, એકવોલેટ, ઈ. વડોદરાના તે અમારા અસીલ સહુઓની ભરતભાઈ પટેલ, રહે. ૨૬, રાહોડકાપર્ક સોસાયટી, નવાબપુરા, ફરજદારના સીધા અને ફરમાણથી જાહેર જનતાને હાલની જાહેર નોટિસ આપી જણાવીએ છીએ કે,

અમારા અસીલનાઓએ વડોદરા મુકામે કાસ્ટર સ્કવેર, ન્યુ